



**NILA
INFRASTRUCTURES
LIMITED**

Nila/Cs/2020/123
Date: November 02, 2020

To,
The Department of Corporate Services
BSE Limited
Phirozee Jeejeebhoy Tower,
Dalal Street, Fort,
Mumbai - 400 001

To,
The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C/1, Block G,
Bandra-Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Scrip Code: 530377

Scrip Symbol: NILAINFRA


Dear Sir,


Reg: Submission of Newspaper Advertisement published for Intimation of Board Meeting to be held on Saturday, November 07, 2020

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are hereby submitting copy of newspaper advertisement published in the Business Standard-English and Loksatta Jansatta- Gujarati edition dated November 02, 2020 regarding the intimation of Board Meeting to be held on Saturday, November 07, 2020.

Please take the same on your record and acknowledge the receipt.

Thanking you,
Yours faithfully,
For, Nila Infrastructures Limited


Dipen Y Parikh
Company Secretary
M. No.: A24031



Encl: a/a

Registered Office:

1st floor, Sambhaav House
Opp. Chief Justice's Bungalow
Bodakdev, Ahmedabad 380015
Tel.: +91 79 4003 6817 / 18, 2687 0258
Fax: +91 79 3012 6371
e-mail: info@nilainfra.com

definition of "Escrow Amount" shall be deemed to include such increase, if any) as may be required to acquire all of the Equity Shares validly tendered in the Delisting Offer at the Exit Price.

(F) In the event of failure of the Delisting Offer, subject to compliance of Regulations 18 and 19 of the Delisting Regulations :

(i) The Escrow Accounts shall be forthwith closed and the amount lying in the said escrow account(s), if any, would be returned to the Acquirer

(ii) The Bank Guarantee furnished by the Acquirer pursuant to Regulation 11(3) of the Delisting Regulations would be released to the Acquirer by the Merchant Bankers.

21. PROPOSED TIME TABLE FOR THE DELISTING OFFER

Activity	Date
Resolution for delisting of Equity Shares passed by the Shareholders of the Company	August 10, 2019
Date of Publication of Public Announcement by the Acquirer	November 2, 2020
Specified Date for determining the names of shareholders to whom the Offer Letters shall be sent*	October 23, 2020
Last Date for dispatch of Letter of Offer and Bid Forms to the Public Shareholders as on Specified Date	November 4, 2020
Bid Opening Date	November 11, 2020
Last date for upward revision or withdrawal of Bids	November 17, 2020
Bid Closing Date	November 18, 2020
Last date for making the Public Announcement of Discovered Price/Exit Price and Acquirer's acceptance / rejection of Discovered Price/Exit Price	November 25, 2020
Last date for payment of consideration for the Offer Shares to be acquired in case of a successful Delisting Offer #	December 3, 2020
Last date for return to Public shareholders of Offer Shares tendered but not acquired under the Delisting Offer	December 3, 2020

* The Specified Date is only for the purpose of determining the names of the Public Shareholders to whom the Letter of Offer will be sent. However, all public shareholders, who are eligible to participate in the delisting offer, can submit their bids through their respective Stock Broker during the bid period.

Subject to the acceptance of the Discovered Price or offer of an Exit Price higher than the Discovered Price or counter offer by the Acquirer

SEBI vide their letter No. WTM/GM/CFDI/21/2020-21 dated July 31, 2020 *inter-alia*, have granted relaxation to the Company by permitting additional timeline for compliance of Regulation 8(1)(d). As per the original schedule, the Company was required to make final delisting application to Stock Exchange on or before August 09, 2020 (*i.e. within 1 year from the date of passing of shareholders' resolution approving the delisting offer*). With the above mentioned relaxation, the last date for approaching the Stock Exchange with final delisting application is December 09, 2020.

Changes, if any, in the aforesaid schedule will be notified to the Public Shareholders by way of corrigendum to the Public Announcement in the same newspapers where the Public Announcement was issued, in addition to being uploaded on the website of the Company / Registrar / BSE / Manager to the Offer.

22. STATUTORY APPROVALS

- (A) The Public Shareholders of the Company have accorded their consent by way of special resolution passed through postal ballot on August 10, 2019.
- (B) The Government of India, Ministry of Chemicals and Fertilizers, Department of Pharmaceuticals has issued its approval vide its letter No. 13012/4/2019-(FDI)-Policy dated March 13, 2020 and letter No. 13012/19/2020(FDI)-Policy dated October 09, 2020 for the proposed acquisition of Equity Shares by Veego through Delisting offer.
- (C) The BSE has given its in-principle approval for delisting of the Equity Shares vide letter dated October 29, 2020.
- (D) The Company and the Promoters have been granted relaxation by SEBI from strict compliance with Regulations 8(1)(d), 10(1) and 12(1) of the SEBI Delisting Regulations *vide* order dated July 31, 2020.
- (E) If the shareholders who are not persons resident in India (including NRIs, OCBs and FIs) had required any approvals (including from the RBI, or any other regulatory body) in respect of the Equity Shares held by them, they will be required to submit such previous approvals, that they would have obtained for holding the Equity Shares, to tender the Equity Shares held by them in this Delisting Offer, alongwith the other documents required to be tendered to accept this Offer. In the event such approvals are not submitted, the Acquirer reserves the right to reject such Equity Shares tendered in the Offer. Further, by agreeing to participate in the

Delisting Offer the non-resident and NRI shareholders are deemed to have given the Company/Acquirer, as the case may be, the authority to make, sign, execute, deliver, acknowledge and perform all applications to file regulatory reporting, if required, including FC-TRS form, if necessary and undertake to provide assistance to the Company/Acquirer for such regulatory reporting, if required by the Company/Acquirer.

(F) To the best of the Acquirer's knowledge, as of the date of the Public Announcement, there are no other statutory or regulatory approvals required to acquire the Offer Shares and implement the Delisting Offer, other than as indicated above. If any statutory or regulatory approvals become applicable, the acquisition of Offer Shares by the Acquirer and the Delisting Offer will be subject to receipt of such statutory or regulatory approvals.

(G) It shall be the responsibility of the Public Shareholders tendering Offer Shares in the Delisting Offer to obtain all requisite approvals (including corporate, statutory or regulatory approvals), if any, prior to tendering the Offer Shares held by them in the Delisting Offer, and the Acquirer shall take no responsibility for the same. The Public Shareholders should attach a copy of any such approval to the Bid Form, wherever applicable.

(H) The Acquirer reserves the right not to proceed with or withdraw the Delisting Offer in the event the conditions mentioned in Section 11 of this PA are not fulfilled or if the approvals indicated above are not obtained or conditions which the Acquirer consider in its sole discretion to be onerous, are imposed in respect of such approvals subject to compliance with SEBI Delisting Regulations as may be applicable.

(I) In the event that receipt of the statutory or regulatory approvals are delayed, changes to the proposed timetable, if any, will be notified to the equity shareholders of the Company by way of a corrigendum to the Public Announcement in the same newspapers in which the Public Announcement is made.

23. NOTES ON TAXATION

Under current Indian tax laws and regulations, capital gains arising from the sale of equity shares in an Indian company are generally taxable in India. Capital gain arising from sale of listed equity shares in a company made on a recognized stock exchange on or after October 1, 2004 and on which securities transaction tax ("STT") was paid at the time of sale, was earlier exempt from tax provided that the shares were held for more than 12 months. The Finance Act 2017 had amended the Income-tax Act, 1961 to provide that the said exemption was available only if STT is paid both at the time of purchase and sale of such shares, or such acquisition has been notified by the central government.

The Finance Act, 2018 has withdrawn the above capital gains tax exemption with effect from April 1, 2018. For any transfer of listed equity shares in a company, held for more than 12 months, on a recognized stock exchange occurring on or after April 1, 2018, the capital gains exceeding Rs. 1,00,000/- are now taxable at a rate of 10%, subject to satisfaction of certain conditions. Further if investments were made on or before 31 January 2018, a method of determining the cost of acquisition of such investments has been specifically laid down. STT will be levied on and collected by a domestic stock exchange on which the equity shares are sold. Further, any gain realized on the sale of listed equity shares held for a period of 12 (twelve) months or less which are sold, will be subject to short term capital gains tax @ 15% (fifteen percent) provided the transaction is chargeable to STT.

THE ABOVE IS ONLY FOR INFORMATION PURPOSE. SHAREHOLDERS ARE ADVISED TO CONSULT THEIR TAX ADVISORS FOR TAX TREATMENT ARISING OUT OF THE DELISTING OFFER AND APPROPRIATE COURSE OF ACTION THAT THEY SHOULD TAKE. THE ACQUIRER / MANAGER TO THE OFFER DO NOT ACCEPT NOR HOLD ANY RESPONSIBILITY FOR ANY TAX LIABILITY, OR ADVICE IN THAT REGARD, ARISING TO ANY SHAREHOLDER AS A REASON OF THIS DELISTING OFFER.

24. CERTIFICATION BY BOARD OF DIRECTORS OF THE COMPANY

- The Board of Directors hereby certify that –
- (a) The Company has not raised any funds by issue of securities during the last five years immediately preceding the date of Public Announcement;
- (b) all material information which is required to be disclosed under the provisions of the erstwhile Listing Agreement and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 entered into between the Company and the Stock Exchange have been disclosed to the BSE, as applicable;
- (c) the Company is in compliance with the applicable provisions of securities laws;
- (d) the Acquirer or Promoter or promoter group or their related entities have not carried out any transaction during the aforesaid period to facilitate the success of the delisting offer which is not in compliance with the provisions of sub-regulation (5) of regulation 4;
- (e) the Delisting Offer is in the interest of the shareholders.

25. DISCLAIMER CLAUSE OF BSE

(A) It is to be distinctly understood that the permission given by BSE to use their network and software of the online OTB platform should not in any way be deemed or construed that the compliance with various statutory and other requirements by the Company, Manager to the

Offer, etc., are cleared or approved by BSE; nor does BSE in any manner warrant, certify or endorse the correctness or completeness of any of the compliance with the statutory and other requirements nor does BSE have any financial responsibility or liability nor does BSE take responsibility in any way for the financial or other soundness of the Company, its promoters or its management.

(B) It is also to be distinctly understood that the approval given by BSE should not in any way be deemed or construed to mean that the PA and the Letter of Offer has been cleared or approved by BSE, nor does BSE in any manner warrant, certify or endorse the correctness or completeness of any of the contents of the announcements, nor does BSE warrant that the securities will be delisted.

(C) Every person who desires to avail of the exit opportunity may do so pursuant to independent inquiry, investigation and analysis and shall not have any claim against BSE or against the Investor Protection Fund set up by BSE whatsoever by reason of any loss which may be suffered by such person consequent to or in connection with such offer and tender of securities through book-building process whether by reason of anything stated or omitted to be stated herein or any other reason whatsoever.



26. COMPLIANCE OFFICER

The Compliance Officer of the Company is Mr. B.P. Thyagaraj. In case the Public Shareholders have any queries concerning the non-receipt of credit or payment for Offer Shares or on delisting processes and procedure, they may address the same to the Compliance Officer or Registrar to the Delisting Offer or the Manager to the Delisting Offer.

27. GENERAL DISCLAIMER

Every person who desires to avail of the Delisting Offer may do so pursuant to independent inquiry, investigation and analysis and shall not have any claim against the Acquirer (including its directors), the Manager to the Offer or the Company (including its officers and directors) whatsoever by reason of any loss which may be suffered by such person consequent to or in connection with such offer and tender of securities through the reverse book-building process through Acquisition Window Facility or OTB or otherwise whether by reason of anything stated or omitted to be stated herein or any other reason whatsoever.

This Public Announcement is not directed towards any person or entity in any jurisdiction or country where the same would be contrary to the applicable laws or regulations or would subject the Acquirer or the Manager to the Delisting Offer to any new or additional registration or other regulatory requirements. The Letter of Offer will not be filed, registered or approved in any jurisdiction outside India. Recipients of the Letter of Offer resident in jurisdictions outside India should inform themselves of and comply with all applicable legal requirements. This is not an offer for sale, or solicitation of an offer to buy in the United States of America and cannot be accepted by any means or instrumentality from within the United States of America.

Manager to the Delisting Offer	Registrar to the Delisting Offer
 <p>Arihant Capital Markets Limited Merchant Banking Division SEBI REGN NO.: INM 000011070 #1011, Solitaire Corporate Park, Guru Hargovindji Road, Chakala, Andheri (E), Mumbai – 400 093 Tel : 022-42254800; Fax : 022-42254880 Email: mbd@arihantcapital.com Website: www.arihantcapital.com Contact Persons: Mr. Amol Kshirsagar / Mr. Satish Kumar P</p>	 <p>Bigshare Services Private Limited SEBI Registration No: INR00001385 1st floor, Bharat Tin Works Building Opp Vasant Oasis, Makwana Road Marol, Andheri (E), Mumbai-400059 Tel: 022-62638200; Fax: 022-62638280 Website: www.bigshareonline.com E-Mail: delisting@bigshareonline.com Contact Person : Mr. Arvind Tandell</p>
Signed for and on behalf of Veego Pharma, LLC	
Sd/- Director	Sd/- Director

Date: October 30, 2020
Place : New Jersey, USA

SAGARDEEP ALLOYS LIMITED
CIN: L29253GJ2007PLC050007
Regd. Off. - Plot No. 2070, Rajnagar Patiya, Santaj Khatri Road, Santaj, Kalol, Gandhinagar 382721 Phone No: +91 93270 36304
Email: secretary@sdalloys.com, Website: www.sdalloys.com

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on **Wednesday, 11th November, 2020** at the Registered Office of the Company to consider and approve *inter alia*, un-audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter ended on **30th September, 2020** and to transact the other businesses mentioned in the Board Meeting Notice.

The said notice is also available on the website of the Company at www.sdalloys.com and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.nseindia.com

By Order of the Board
SATISHKUMAR MEHTA
Managing Director (DIN: 01958984)

Date: 31st October, 2020

NILA INFRASTRUCTURES LIMITED
CIN : L45201GJ1990PLC013417
Registered Office: 1st Floor, Samhahav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.
Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922
E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

NOTICE

Notice, pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on Saturday, November 07, 2020 at Registered Office of the Company to consider and approve unaudited standalone and consolidated financial results for the second quarter and half year ended on September 30, 2020.

You may also refer the website of the Company at www.nilainfra.com and stock exchange(s) at www.bseindia.com and www.nseindia.com for further details.

Date: October 31, 2020 For, **Nil Infrastructures Limited**
Place: Ahmedabad Dipen Parikh-Company Secretary

VISTAR AMAR LIMITED
Reg. Off.: Plot - A4, APMC - MAFCO Yard, Sector 18, Vashi, Navi Mumbai - 400703
Tel: +91 22 27880820 Website: www.vistaramar.com
CIN No.: L05000MH1983PLC272707

NOTICE

Pursuant to the Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company M/s. Vistar Amar Limited is scheduled to be held on Tuesday, the 10th November, 2020 at 05:00 p.m. at Plot - A4, APMC - MAFCO Yard, Sector 18, Vashi, Navi Mumbai - 400703 *inter-alia* to consider and approve the Un-audited Financial Results of the Company for the quarter and half year ended 30th September, 2020.

The said information is also available on the Company's website at www.vistaramar.com and may also be available on the website of the Stock Exchange at www.bseindia.com.

For Vistar Amar Limited
Ramesh Panjri
Managing Director
DIN No. 00300737

Place: Navi Mumbai
Date: 31-10-2020

EURO MULTIVISION LIMITED
CIN: L32300MH2004PLC145995
Registered Office: F/12, Ground Floor, Sangam Arcade, Vallabhkhadi Road, Vile Parle (West), Mumbai 400 056
Phone: +91-22-4036 4036; Fax: +91-22-4036 4037;
E-mail: info@euromultivision.com; Website: www.euromultivision.com

PUBLIC NOTICE

The Members are hereby informed that the 16th (Sixteenth) Annual General Meeting ("AGM") of the Members of **Euro Multivision Limited** will be held on Wednesday, 25th November, 2020 at 10.00 a.m. (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the Notice of 16th AGM which will be e-mailed separately to the members in due course.

Pursuant to the General Circular numbers 20/2020 dated 5th May, 2020, 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI") (hereinafter collectively referred to as "the Circulars"), companies are allowed to hold AGM through VC/OAVM, without the physical presence of members at a common venue. In compliance with the aforesaid Circulars, Companies Act, 2013 ("the Act") and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") the AGM of the Company will be held through VC/OAVM.

Notice and the Annual Report for the financial year ended 31st March, 2020 will be sent electronically to those Members whose e-mail address(es) are registered with the Company/Depository Participant(s)/Registrar and Share Transfer Agent. The copy of the Notice will also be made available on the website of the Company viz., www.euromultivision.com and on the websites of the Stock Exchanges where the equity shares of the Company are listed BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com and on the Website of Central Depository Services (India) Limited ("CDSL") www.evotingindia.com.

In line with the Circulars issued by MCA and SEBI, Members are advised to update their Email Ids in order to receive electronic copies of Annual Report/login credentials, in the manner mentioned below, since no physical copies of Annual report will be dispatched to any member:

Members hold shares in physical mode and have not update their email addresses with the Company/Depository Participant(s)/Registrar and Share Transfer Agent ("RTA") are requested to update their email addresses by writing to Company's email id or RTA email id Link Intime India Private Limited with the subject line "Request to update email id" at rt.helpdesk@linkintime.co.in. Members are requested to submit request letter mentioning the Folio No. and Name of Member along with the scanned copy of the Share Certificate (front and back), PAN (self - attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card). Members hold shares in dematerialized mode and have update their email addresses are requested to register/update their email addresses with the Depository Participant(s) or by email to the Company's email id or RTA email id info@euromultivision.com / rt.helpdesk@linkintime.co.in.

The Company and RTA Shall Co-ordinate with CDSL and provide login credentials to the above mentioned shareholders, subject to the receipt of the required documents and information from the members.

VOTING THROUGH ELECTRONIC MODE (E-VOTING):
The Company has entered into agreement with Central Depository Services (India) Limited (CDSL), authorized e-voting agency, for facilitating voting through electronic means ("remote e-voting") to enable the members to exercise their right to vote on the resolution proposed to be passed at the AGM as well as for the members who are present at the AGM through VC/ OAVM facility and wish to cast their vote during the AGM, through e-voting system ("e-voting")

The manner of "remote e-voting and "e-voting" during the AGM, for members holding shares in physical mode, dematerialized mode and for members who have not registered their e-mail addresses will be provided in details in the Notice of the AGM.

In case you have any queries or issues regarding e-voting/remotely e-voting, you may contact Mr. Rakesh Dalvi, Manager, (CDSL.) at helpdesk.evoting@cdslindia.com or call at 1800225533.

For Euro Multivision Limited
Sd/-
Hitesh Shah
Chairman & Whole Time Director
DIN: 00043059

Place: Mumbai
Date: October 31, 2020

PUBLIC NOTICE
ENVIRONMENTAL CLEARANCE

It is hereby informed that the State Level Environment Impact Assessment Authority (SEIAA), Paryavaran Bhavan, Sector 10-A, Gandhinagar-382 010, has accorded Environmental Clearance for Setting up Manufacturing Plant of Synthetic Organic Chemicals (API & Its Intermediates) at Survey No. 630, At Nana Vadala, Tal. Kalawad, Dist: Jamnagar, Gujarat, of M/s. **Perna Life Sciences** vide letter No. SEIAA/GUJ/EC/5(0)/1157/2020 Dated 09/10/2020, under the provision of EIA Notification dated 14th September 2006.

Copies of Clearance letter are available with website of SEAC/SEIAA

AUTHORIZED SIGNATORY
M/s. Perna Life Sciences

Date : 28/10/2020

HDFC Housing Development Finance Corporation Ltd. POSSESSION NOTICE
HDFC House, Nr. Mitthakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone : (079) 68307000

Corrigendum To Possession Notice

Please our Possession Notice published on 28-10-2020 on **Page 14. Srl. No.-4 Mr. Naushad Suleman Khan. The Symbolic Possession date mentioned as 20th Oct., 2020. Please read the same as Symbolic Possession Date... 22nd Oct., 2020.**

All other details of the Possession Notice remains the same.

Date : 27/31-10-2020 For Housing Development Finance Corporation Ltd.
Place : Ahmedabad/Bhuj Sd/-
Authorized Officer

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020.
Corporate Identity Number - CIN - L70100MH97PLC019916. E-mail - customercare@hdfc.com, Website - www.hdfc.com

PUBLIC NOTICE

That our Client Mamtaben Rajeshbhai Patel & Rajesh Kanjibhai Patel have demanded for the title clearance certificate for Property situated at non agriculture plot of land bearing R.S., no.141,154,157 & 161, Revenue Block no. 233 / B land admeasuring 16188 Sq.Mtrs., Known as "Vishwa Villa" paikki Plot no.52, after K.J.P. Revenue Block no.233-B/52, as per approved plan admeasuring 101.26 Sq.Mtrs., as per site admeasuring 119.81 Sq.Mtrs., undivided share of land admeasuring 83.95 Sq.Mtrs., Total admeasuring 203.76 Sq.Mtrs., At Mauje Isanpor, Registration District & Sub-District Olpad, District Surat. That the captioned property was previously owned by Piyush Rameshbhai Zadafiya through a Sale deed Vides Registration No.6906 dated 30.03.2018, wherein the said Original Sale Deed, and Registration Receipt are found to be missing & therefore if any individual, Bank or any Financial Institution has its charge or lien on the said property then within 07 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not send in given period then my client will initiate further proceedings.
Date - 01-11-2020. Under the instruction from the client.

SAPAN TEREDesai (ADVOCATE)
Office: 205 / A, 2nd Floor, 21st Century Complex, Ring Road, Surat. (M) 9426306324

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL
BENCH AT AHMEDABAD
COMPANY PETITION NO. CP (CAA) NO. 53 OF 2020 CONNECTED WITH
COMPANY APPLICATION NO. CA (CAA) NO 45 OF 2020

In the matter of Section 230 to 232 of the Companies Act, 2013 AND
In the matter of Scheme of Amalgamation between **Saibaba Trading Private Limited, Shyam Cottab Private Limited and Mukund Fashion Private Limited** and their respective shareholders and creditors;

Saibaba Trading Private Limited (CIN:U65910GJ1986PT0008990) having its Registered Office at 4, 2nd Floor, New Cloth Market Ahmedabad- 380002 Gujarat
.....Petitioner Company No.1/ Transferor Company No.1

Shyam Cottab Private Limited (CIN: U17120GJ2010PTC060692) and having its Registered Office at E-1 To 8, Sumel Business Park-1, Second Floor, B/H. New Cloth Market, Ahmedabad 380002 - Gujarat
.....Petitioner Company No. 2/ Transferor Company No. 2

Mukund Fashion Private Limited (CIN: U18109GJ2009PTC056298) and having its Registered Office at E-1 To 8, Sumel Business Park-1, Second Floor, B/H. New Cloth Market, Ahmedabad 380002 Gujarat
.....Petitioner Company No. 3/ Transferee Company

NOTICE OF HEARING OF PETITION

Joint Petition under Sections 230 to 232 of the Companies Act, 2013 was presented by Saibaba Trading Pvt. Ltd, Shyam Cottab Private Limited and Mukund Fashions Private Limited on 9th October, 2020 for sanctioning of the Scheme of Amalgamation between Saibaba Trading Pvt. Ltd, Shyam Cottab Private Limited and Mukund Fashions Private Limited and their respective shareholders and creditors and the Petition was admitted by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad on 20 th October, 2020. The said Petition is fixed for hearing before the said Hon'ble Tribunal on 6th day of January 2021 at 10.30 a.m. in the morning or soon thereafter.

ANY PERSON desirous of supporting or opposing the said Petitions should send to the Petitioner's Advocates at their address mentioned hereunder, a notice of his intention, signed by him or his Advocate, with his full name and address, so as to reach the Petitioner's Advocate not later than two days before the date fixed for the hearing of the Petition. Where he seeks to oppose the Petition, the grounds of opposition or a copy of the affidavit intended to be used in opposition to the Petition, should be filed in Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench at Corporate Bhavan, b/h Zyudus Hospital, S. G. Highway, Thaltej, Ahmedabad, 380054 and a copy thereof served on the Petitioner's Advocate, not less than two days before the date fixed for hearing. A copy of the Petition will be furnished by the Petitioner's Advocates to any person requiring the same on payment of the prescribed charges.

Date : November 02, 2020 Sd/- **Tirth Nayak - Advocate**
Place : Ahmedabad Address: A-403, Ship Aarun, Sindhu Bhavan Road, Nr. Pakwan Cross Roads, Thaltej, Ahmedabad- 54
• Email: tirth.nayak@gmail.com

INDIA HOME LOAN LTD.
CIN: L65910MH1990PLC059499
Regd. & Corporate Office: 504, Nirmla Ecstasy, 6th Floor, Jatashakar Dossra Road, Mulund (W) Mumbai 400080

Branch Office: A-202, Ganesh Plaza building, Near Navrangpura Post Office, Navrangpura, Ahmedabad 380 009. Phone No. (079) 26449918

POSSESSION CUM SALE NOTICE
(For IMMOVABLE PROPERTY) [RULE 8-(1)]

Whereas, the undersigned being the Authorised Officer of INDIA HOME LOAN LTD. (IHLL) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 has taken over Physical Possession of the following properties mentioned hereunder.

Now, expression of Interest is invited for sale of the said properties " AS IS AND WHAT IS " basis from interested parties.

Interested parties are requested to contact Ahmedabad branch office of IHLL for inspection, details and / or discussion.

DETAILS PHYSICAL POSSESSION TAKEN BY IHLL OF SECURED ASSET

PART - I: All that piece and parcel of land bearing Survey / Block no. 220 (part), admeasuring 5261 sq. mtrs., Khata No. 867, Near Prantji Overbridge, NH No. 8, Village and Taluka: Prantji - 383205, Dist.: Sabarkantha (Gujarat) and bounded as follows: On or towards the North By: Survey No. 219; On or towards the South By: Survey No. 225; On or towards the East By: Survey No. 221; On or towards the West By: Road.

PART-II: Description of the unsold bungalows developed by M/s Dwarshesh Developers and known as "Dwarshesh Park" built on the land detailed in Part-I above:

Sr. No.	Bungalow No.	Bungalow Area (Sq. Mtr)	Common Plot /Road Area (Sq. Mtr)	Total Area (Sq. Mtr)
1	5	140.47	37.53	178.00
2	6	140.47	37.53	178.00
3	7	140.47	37.53	178.00
4	8	140.47	37.53	178.00
5	15	140.47	37.53	178.00
6	16	140.47	37.53	178.00
7	17	140.47	37.53	178.00
8	18	140.47	37.53	178.00
9	19	156.35	38.65	195.00
10	20	156.35	38.65	195.00
11	21	156.35	38.65	195.00

Date: 31/10/2020 Sd/- Authorized Officer
Place: Ahmedabad India Home Loan Limited

